

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૧૦/૨૦૧૬ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૧૬/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૦ કેસ કરી, ૦૮ વ્યક્તિઓને ઝડપી ૨૬ લીટર દેશી દારૂ અને ૧૨૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૪ કેસ કરી ૦૪ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૧૧,૮૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૧૭/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૩ વ્યક્તિઓની તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૧૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૮૧૮/૧૬

આનંદનગર : મલય કનૈયાલાલ પડિયા (ઉ.વ.૪૬)(રહે,સ્વનીલ ફ્લેટ, કુલવાડી ચોક હિલ ડ્રાઇવ ભાવનગર) એ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૧૦/૧૬ ના કલાક ૧૨/૩૦ થી ૨/૩૦ સુધીનાં સમયગાળા દરમિયાન સેલ પેટ્રોલ પંપની ઇન્ડ્રપ્રસ્થ કોર્પોરેટ બિલ્ડિંગની નીચે બંધેજ શોરૂમ સામે રોડ ઉપર પોતાની ઇનોવા કાર પાર્ક કરી હતી. જે કારનો દરવાજો ખોલી અજાણી વ્યક્તિ કારમાંથી લેપટોપ નંગ-૨ કિંમત રૂપિયા ૪૫,૦૦૦/-, પેનડ્રાઇવ, ડેબીટકાર્ડ, આઇકાર્ડ, પાસપોર્ટ, કપડાં અને જરૂરી દસ્તાવેજ ભરેલ બેગ નંગ-૩ ની ચોરી કરી પલાયન થઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એફ.એ.પારગી ચલાવે છે.

અમરાઇવાડી : હિતેન્દ્રકુમાર શીવાભાઈ રાઠોડ (ઉ.વ.૪૦)(રહે, તેજેન્દ્ર પોઈન્ટ રો-હાઉસ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તા પાસે, અમરાઇવાડી) એ તા.૩/૧૦/૧૬ નારોજ અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૯/૧૬ ના કલાક ૯/૪૫ વાગ્યાનાં સુમારે અમરાઇવાડી પોસ્ટ ઓફિસ નજીક, લક્ષ્મી વિજય કાપડની દુકાન પાસે આવેલ એસ.બી.આઈ. ના એ.ટી.એમ. માંથી કોઇ અજાણી વ્યક્તિ હિતેન્દ્રકુમારની પત્નીનાં ATM માંથી રૂપિયા ૩૮,૦૦૦/- કોઈ પણ રીતે ઉપાડી ચોરી કરી લઈ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.એસ.પાટીલ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૮૧૯/૧૬

વસ્ત્રાપુર : રોહિત કિશનભાઈ પંચાલ (રહે. નિર્મલ એપાર્ટમેન્ટ, જય મંગલ બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે, નારણપુરા) એ તા.૩/૧૦/૧૬ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૦૧/૧૦/૧૬ બપોરના ૪/૦૦ થી રાતનાં ૮/૩૦ વાગ્યા દરમ્યાન એસ.જી.હાઈવે, બોડકદેવ, ગુરુદ્વારા સામે રોડ ઉપર પાર્ક કરેલ પોતાનાં ભાઈની હુન્ડાઈ સેન્ટ્રો કાર નંબર. આર.જે.૨૦.સી.એ.૬૮૭૧ કિમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એસ. બોદર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.